

ન્યુઝ ઓફ ગાંધીનગર

NEWS OF GANDHINAGAR

(Daily)

દૈનિક

E mail - prdpraval@yahoo.co.uk

*Editor : Pradip A. Raval (Mo) 98246 53073 * Block No.677/2, Gh Type, Sector - 8, Gandhinagar (Gujarat)

* Volume : 7 * Issue No. 82 * Date: 18.01.2021 Monday * Page :04 * Rs. 1.00/- * Annual Rs. 351/-

દિલ્લી, પશ્ચિમ બંગાળ, તેલંગાના અને રાજસ્થાનમાં વેક્સીનેશન બાદ આડઅસર જોવા મળી દિલ્લીમાં કોરોના વેક્સીન બાદ પર લોકોમાં જોવા મળી સાઈડ ઈફેક્ટ

ન્યુ દિલ્લી, તા. ૧૭ દેશભરમાં કોરોના વેક્સીનેશન અભિયાન શરૂ થઈ ગયું છે. કેટલાંક લોકોમાં આ રસીકરણની સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી રહી છે. દિલ્લીમાં વેક્સીન લગાવ્યા બાદ પર લોકોમાં તેની સાઈડ ઈફેક્ટ જોવા મળી. રસી લગાવ્યા પછી આ લોકોની તબિયત ખરાબ થઈ હોવાની ખબર સામે આવી. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે. ૧૬ જાન્યુઆરીને શનિવારના રોજથી લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા માટે દેશભરમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં

આવી. પહેલાં દિવસે સફાઈ કર્મીઓ અને સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીન આપવામાં આવી. જેમાં બે સ્વાસ્થ્ય કર્મીઓને રસી અપાયા પછી એલર્જીની ફરિયાદ સામે આવી. કેટલાંક સ્થળોએ વેક્સીન અપાયા પછી સામાન્ય ફરિયાદો પણ સામે આવી. કેટલાંકને ગભરામણની સમસ્યા પણ ઉભી થઈ. ત્યારે આ પૈકીના એક કર્મચારીને વેક્સીન અપાયા પછી તબિયત વધુ ખરાબ થતા એઈએફઆઈ સેન્ટર મોકલવાની નોબત આવી. રાજધાની દિલ્લીમાં શનિવારે સ્વાસ્થ્યકર્મીઓ અને સફાઈકર્મીઓને રસી આપીને

રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી. જેમાં દિલ્લીમાં ગઈકાલે ૪૩૧૮ લોકોને કોરોનાની રસી આપવામાં આવી. જેમાં પર મોટી સાઈડ ઈફેક્ટ જોવા મળી. જેમાંથી એકની હાલત નાજૂક હોવાનું પણ સામે આવ્યું છે. દિલ્લીના કુલ ૧૧ જિલ્લામાં લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા રસી આપવામાં આવી. કોરોના વાયરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે ભારતમાં રસીકરણ મહાઅભિયાનની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રસી લગાવ્યા બાદ જો કોઈને કોઈપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ થાય તો તેના માટે પણ

સરકાર અલગથી વ્યવસ્થા કરી છે. ભારત સરકારે દરેક રસીકરણ કેન્દ્રની બહાર એઈએફઆઈ સેન્ટર તૈયાર કર્યા છે. જ્યાં વેક્સીનેશન પછી કોઈપણ પ્રકારની આડઅસર થઈ હોય તેવા દર્દીઓને સારવાર આપવામાં આવે છે. દિલ્લી, પશ્ચિમ બંગાળ, તેલંગાના અને રાજસ્થાનમાં વેક્સીનેશન બાદ આડઅસર જોવા મળી. રસી અપાયા બાદ લોકોમાં સાઈડ ઈફેક્ટ જોવા મળી. જેમાં લોકોને નાની-મોટી સમસ્યાઓ સર્જઈ હોવાની ફરિયાદો સામે આવી. જોકે, દિલ્લીમાં એકની સ્થિતિ વધુ ગંભીર હોવાનું પણ સામે આવ્યું. દુનિયાભરમાં લોકોને



કોરોનાના સંક્રમણથી બચાવવા માટે વેક્સીન આપવામાં આવી રહી છે. અલગ અલગ દેશોમાં અલગ અલગ કંપનીઓ દ્વારા તૈયાર કરાયેલી વેક્સીનેશન મંજૂરી અપાઈ છે. વેક્સીન અપાયા બાદ લોકોમાં તેની સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી છે. ત્યારે નોર્વેમાં રસીકરણની ખુબ જ ગંભીર અસર થઈ હોવાનું સામે આવ્યું. Norway માં Pfizer ની કોરોના વેક્સીન લગાવ્યા બાદ ૨૩ લોકોની મોત થઈ હોવાની ખબરે હાહાકાર મચાવી દીધો છે.

બ્રિટનના વડાપ્રધાને પીએમ મોદીને જી-૭માં ભાગ લેવા આમંત્રણ આપ્યું

ન્યુ દિલ્લી, તા. ૧૭ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જી-૭માં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. આ સમ્મેલન જૂન મહિનામાં બ્રિટનના કોર્નવોલમાં યોજાશે. જી-૭ સમુદાયમાં દુનિયાની સૌથી શક્તિશાળી ૭ આર્થિક મહાશક્તિઓ કે જેમાં બ્રિટન, અમેરિકા, કેનેડા, ફ્રાંસ, જર્મની, જાપાન અને યુરોપિયન યૂનિયન સામેલ છે. આ સમુદાય કોરોના વાયરસ મહામારી, જળવાયિ પરિવર્તન અને મુક્ત વ્યાપાર જેવા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને જી-૭ પહેલા ભારતની મુલાકાતે પણ આની શકે છે. બોરિસ જોનસને આમ તો ૨૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે યોજનારી પરેડમાં મુખ્ય અતિથિ તરીકે જાહેર રહેવાનું હતું પરંતુ બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન મળી આવતા તેમણે પોતાનો ભારત પ્રવાસ રદ

કરવો પડ્યો હતો. આ વખતે શિખર સંમેલન બ્રિટનના કોર્નવોલમાં ૧૧ થી ૧૩ જૂન દરમિયાન આયોજિત કરવામાં આવશે. આ સમિટમાં દુનિયાના સાત મુખ્ય દેશોના નેતા કોરોના વાયરસ સંકટ અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવાના પડકારો પર ચર્ચા કરશે. આ વખતે જી-૭ શિખર સંમેલનમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાને પણ મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયાની ફાઈવ્થીના રૂપમાં ભારત પહેલાથી જ દુનિયાના ૫૦ ટકાથી વધુ વેક્સીન પુરી પડે છે. યુનાઈટેડ કિંગડમ અને ભારતે કોરોના જેવી મહામારી દરમિયાન એક સાથે મળી કામ કર્યું છે. અમારા વડાપ્રધાન સતત વાતચીત કરતા રહે છે અને પીએમ જોનસને કહ્યું છે કે જી-૭ સંમેલનથી પહેલા તેઓ ભારતનો પ્રવાસ કરશે. આ વર્ષે ગણતંત્ર દિવસ સમારોહમાં જોનસને મુખ્ય મહેમાન તરીકે

આમંત્રિત કરવામાં આવ્યા હતા, પરંતુ કોવિડ-૧૯ના વધતા કેસના કારણે તેમણે પોતાનો પ્રવાસ રદ કર્યો હતો. દુનિયાના મુખ્ય લોકતંત્રોના રાષ્ટ્રાધ્યક્ષ સંયુક્ત પડકારોનો સામનો કરવા માટે બ્રિટનમાં એક કારણે આવશે. તમામ દિગ્ગજ નેતા કોરોના વાયરસની માર અને જળવાયુ પરિવર્તનનો સામનો કરવા મામલે ચર્ચા કરશે. સાથોસાથ એવું પણ સુનિશ્ચિત કરશે કે દરેક સ્થળે લોકો ખુલ્લા વેપાર, ટેક્નીકલ પરિવર્તન અને વૈજ્ઞાનિક શોધથી ફાયદો ઉઠાવી શકે. બ્રિટનના આંતરરાષ્ટ્રીય નેતૃત્વને ધ્યાને લઈ આ વર્ષે ખૂબ જ અગત્યનું છે. આ વર્ષે જી-૭ શિખર સંમેલન ઉપરાંત બ્રિટન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરશે. અને આ વર્ષના અંતમાં તે ગ્લાસગોમાં ગ્રૅન-૨૬ની મેજબાની કરશે અને વિકાસશીલ દેશોમાં બાળકોને સ્કૂલમાં લાવવાના ઉદ્દેશ્યથી એક ગ્લોબલ શિક્ષણ સંમેલન થશે.

વિદેશ મંત્રાલયની મીટિંગમાં ચીનને લઈ રાહુલ ગાંધીએ કહ્યું- સરકાર ઉપલબ્ધિઓ ના ગણાવે, એક 'સ્પષ્ટ અને મજબૂત' રણનીતિ સામે મૂકે

ન્યુ દિલ્લી, તા. ૧૭ વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ખૂબ આકરી ચર્ચા જોવા મળી. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વૈશ્વિક પડકારોમાં ખાસ કરીને ચીન સામેના પડકારો માટે સ્પષ્ટ રણનીતિની માંગણી કરી. ત્યારબાદ વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ હર્ષ શ્રીગલાએ ક્યાંય સુધી તેમને જવાબ આપ્યા. ચીનને લઈ મંત્રી એક કલાક સુધી પ્રોબ્લેમેશન આપ્યું તેને રાહુલ ગાંધીએ 'લોન્ડો લિસ્ટ' બતાવીને રદ કરી દીધું. મીટિંગમાં હાજર કોંગ્રેસના જ શિશિ થરુરએ પણ આ વાત દોહરાવી. ગાંધી અને જયશંકરની વચ્ચે કેટલીય વાક્યોમાં સમેટી શકાય. 'રાહુલે અંદાજે સાડા ત્રણ કલાકની મીટિંગમાં બે કલાકથી વધુ સમય જયશંકર અને શ્રીગલા જ જવાબ આપતા રહ્યા. રાહુલએ સરકારની વિરુદ્ધ આરોપોનો વરસાદ કરતાં કહ્યું કે તેઓ પોતાની ઉપલબ્ધિઓ ના ગણાવે, પરંતુ એક 'સ્પષ્ટ અને

મજબૂત' રણનીતિ સામે મૂકે. સૂત્રોના મતે જયશંકરે કહ્યું કે ચીને પૂર્વ લદાખમાં જે કર્યું તેમાં શાંતિ ભંગ થઈ છે. તેમણે કહ્યું કે સરકારની રણનીતિ અત્યારે એ છે કે સરહદવર્તી વિસ્તારોમાં સૈનિક તૈનાત રખાશે અને સશસ્ત્ર બળોને સપોર્ટ કરવામાં આવે. વિદેશ મંત્રીના મતે ચીનને સમસ્યા ભારતના બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાથી છે. તેમણે કહ્યું કે ૨૦૧૪ સુધીમાં ધીમું હતું. ત્યારબાદથી સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બજેટને વધારી દીધું અને તેને લાગુ કરવાની સ્પીડને ચારગણી કરી દીધી. ગાંધીએ સરકારને સ્પષ્ટ કર્યું કે શું તેમની પાસે કોઈ વ્યૂહરચના છે કે જેને 'ગ્રાહ વાક્યોમાં સમેટી શકાય.' રાહુલે અંદાજે સાડા ત્રણ કલાકની મીટિંગમાં બે કલાકથી વધુ સમય જયશંકર અને શ્રીગલા જ જવાબ આપતા રહ્યા. રાહુલએ સરકારની વિરુદ્ધ આરોપોનો વરસાદ કરતાં કહ્યું કે તેઓ પોતાની ઉપલબ્ધિઓ ના ગણાવે, પરંતુ એક 'સ્પષ્ટ અને

(સીપીઈસી) દ્વારા અખાત સાથે ભારતના કેન્દ્રિય સ્વરૂપ નબળું પડી જશે. તેમણે એ પણ પૂછ્યું કે શું ભારત પાસે 'બાઈપોલર' વિશ્વ (અમેરિકા ટૂંક ચીન) માટે કોઈ વ્યૂહરચના છે? જયશંકરે જવાબ આપ્યો કે બીઆરઆઈ અને કનેક્ટિવિટીને લઈ ભારતની વ્યૂહરચના સૌ પ્રથમ ૨૦૧૭ માં બીઆરઆઈ ફોરમથી સ્પષ્ટ થઈ ગઈ હતી. ભારતની જે પોઝિશન હતી તેવી જ પોઝિશન હવે વિશ્વના ઘણા દેશો લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત એ કોશિષમાં છે અને મલ્ટી-પોલર દુનિયા બની શકે. આ દિશામાં પ્રથમ પગલું મલ્ટી-પોલર એશિયા બનાવવાનું હશે. રાહુલે કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે મીટિંગની મિનિટ્સ અગાઉથી સફૂલેટ કરવામાં આવે. આ અંગે જયશંકરે કહ્યું કે અગાઉના વર્ષોમાં આવું બન્યું હતું, પરંતુ જ્યારે પ્રણવ મુખર્જી વિદેશમંત્રી હતા ત્યારે સુરક્ષાના કારણોને લીધે તેમણે આમ કરવાનું બંધ કરી દીધું હતું.

પીએમ કેર્સ ફંડની પારદર્શિતાને લઈ ૧૦૦ પૂર્વ આઈએએસ અધિકારીઓનો વડાપ્રધાનને પત્ર

ન્યુ દિલ્લી, તા. ૧૭ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૧૦૦ પૂર્વ સિવિલ સેવા અધિકારીઓએ એક ખુલ્લો પત્ર લખ્યો છે. આ પૂર્વ સિવિલ સેવા અધિકારીઓના જુથે પોતાના ઓપન લેટરમાં પીએમ કેર્સ ફંડની પારદર્શિતાને લઈને સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, પબ્લિક એકાઉન્ટેબિલિટીના સ્ટરને બનાવી રાખવા માટે પીએમ કેર્સ ફંડમાં પારદર્શિતા ઘણી જરૂરી છે. કોઈ પણ પ્રકારની ગડબડને રોકવા માટે ફંડમાં યોગદાન કરનારા અને તેનાથી ખર્ચ થતા આંકડાને તમામ માટે ઉપલબ્ધ કરાવવા જોઈએ. પૂર્વ સિવિલ સેવા અધિકારીઓના રૂપે

પોતાના પત્રમાં લખ્યું, અમે તમામ કોરોના મહામારીથી પ્રભાવિત થયેલા લોકોને રાહત આપવા માટે બનાવવામાં આવેલા પીએમ કેર્સ ફંડ અને તેની સાથે જોડાયેલી ચર્ચા પર સતત નજર રાખી રહ્યા છીએ. જે ઉદ્દેશ્ય માટે આ ફંડ બનાવવામાં આવ્યું હતું અને જે રીતે તેને ચલાવવામાં આવ્યું છે આ બન્ને વસ્તુ કેટલાક સવાલના જવાબ આપ્યા વગર છોડી દે છે. પત્રમાં આગળ લખ્યું છે કે વડાપ્રધાન સર્બપિત તમામ વસ્તુમાં પારદર્શિતા લાવી, વડાપ્રધાન પદની ગરીમા અને તેનું સન્માન બનાવી રાખવું જરૂરી છે. વડાપ્રધાનના નામે લખવામાં આવેલા આ પત્ર પર પૂર્વ

આઈએએસ અધિકારીઓ- અનીતા અગ્નિહોત્રી, એસપી એમ્બ્રોસ, શરદ બેહર, સફાદ હસન, હર્ષ મંદર, પી.જોય ઓમન, અરુણા રોય, પૂર્વ રાજનાયક મધુ ભાદુરી, કેપી કેબિયન, દેબ મુખરજી, સુજાતા સિંહ સિવાય પૂર્વ આઈપીએસ અધિકારીઓ- એ.એસ. દુલત, પી.જે.જે. નેમપુથિરી અને જૂલિયો રિબેરોએ પોતાના હસ્તાક્ષર કર્યા છે. કોરોના મહામારીના ભારતમાં દસ્તક આપવામાં આવ્યા બાદ કેન્દ્રએ માર્ચ ૨૦૨૦માં પ્રધાનમંત્રી સિટિજન અસિસ્ટન્સ એન્ડ રિલીફ ઈન ઈમરજન્સી સિસ્ટ્યુએશન્સ (પીએમ-કેર્સ) ફંડની શરૂઆત કરી હતી.

ન્યુઝ ઓફ ગાંધીનગર કોરોના અપડેટ
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા: ૫૧૮
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો : ૨૫૫૮૭૨
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં લોકોનાં મૃત્યુ: ૦૨
રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા : ૭૦૪
ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા : ૨૪૫૨૦૭

દેશમાં રવી પાકોનું વિક્રમી વાવેતરઃ ઘઉંની નિકાસ વધવાની શક્યતા

ન્યુ દિલ્લી, તા. ૧૭ દેશમાં આ વર્ષે ચોમાસામાં સારોએવો વરસાદ પડ્યા પછી ચાલુ રવી સીઝન દરમિયાન શિયાળુ કૃષિ પાકોનું વાવેતર વિક્રમી સ્તરે પહોંચી ગયું છે. કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ મુજબ દેશમાં ૧૫ જાન્યુઆરી, ૨૦૨૧ સુધી ૬૫૨ લાખ હેક્ટરમાં શિયાળુ પાકોનું વાવેતર થયું છે, જે ગયા વર્ષની તુલનાએ વાવેતર વિસ્તારમાં દોઢ ટકાનો વધારો દર્શાવે છે. જ્યારે ગઈ રવી સીઝનમાં સમીક્ષા હેઠળના ગાળા દરમિયાનમાં

૬૪૨ લાખ હેક્ટરમાં કૃષિ પાકોનું વાવેતર થયું હતું. રવી પાકોના વાવેતરમાં વધારો મુખ્યત્વે ઘઉં, ચોખા, ચણા સહિતના કઠોળ અને તેલીબિયાં પાકોના ક્ષેત્રફળમાં વૃદ્ધિને આભારી છે. રવી સીઝનના મુખ્ય પાક ઘઉંનું વાવેતર બે ટકા વધીને ૩૩૭.૧૪ લાખ હેક્ટરમાં થયું હતું. તેવી જ રીતે ચોખાનો વાવેતર વિસ્તાર પણ ૫ ટકા વધીને ૨૧.૦૪ લાખ હેક્ટર થયો છે. પંજાબ, હરિયાણા રાજ્યમાં ખેડૂતો આંદોલન વચ્ચે પણ ઘઉં અને ચોખાના વાવેતરમાં વધારો થયો

છે. આ વર્ષે દેશમાં ઘઉંની નિકાસ ત્રણ ગણી વધવાની સંભાવના છે. જોહાણના જણાવ્યા મુજબ ૨૦૨૦-૨૧માં ભારતના ઘઉંની નિકાસ ૧૮ લાખ ટને પહોંચે એવી શક્યતા છે. ગયા વર્ષે દેશમાં ઘઉંનું નોંધપાત્ર રહ્યું હતું અને આ સીઝનમાં પણ ઉત્પાદન વધવાની અપેક્ષા છે. દેશમાંથી વર્ષ ૨૦૧૯-૨૦માં ૫.૯૫ લાખ ટનની ઘઉંના નિકાસ થઈ હતી. યુએસડીએના અંદાજ લગાવ્યો હતો કે વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતથી ૧૮ લાખ ટન નિકાસ સંભવ છે.

Pradip Raval
(National-International-Editor-Owner)
https://youtu.be/FdqBvj_oZz0
Live On janfariyadnews TV FB Page & YouTube channel
www.janfariyadnews.com

દેશમાં ૨૪ કલાકમાં ૧૫.૧૪૪ નવા કેસ નોંધાયા, ૧૮૧ દર્દીનાં મોત



ન્યુ દિલ્લી, તા. ૧૭ દેશમાં શનિવારથી કોરોના વેક્સીનેશનનું અભિયાન શરૂ થતાં કોવિડ-૧૯ સામેની લડાઈ વધુ મજબૂત બની છે. બીજી તરફ સંક્રમિત થતા દર્દીઓની સંખ્યામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ઉપરાંત મૃત્યુદર પણ કાબૂમાં આવી રહ્યો છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૫,૧૪૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૮૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૫,૫૭,૯૮૫ થઈ ગઈ છે. દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧ લાખ પર હજાર ૨૭૪ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૭,૧૭૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૦૮,૮૨૬ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૨,૨૭૪ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કોર્પોરેશન ઓફ મેડિકલ

રિસર્ચને જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૬ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૮,૬૫,૪૪,૮૬૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના ૨૪ કલાકમાં ૭,૭૯,૩૭૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં ૫૦૫ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે રાજ્યભરમાંથી ૭૬૪ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા હતા. આમ રિકવરિ રેટ ૯૫.૭૧ ટકા જેટલો થયો છે. રાજ્યમાં અત્યાર અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે ૨,૪૪,૪૦૭ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી લાખ પર હજાર ૨૭૪ લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૭,૧૭૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૦૮,૮૨૬ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૨,૨૭૪ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કોર્પોરેશન ઓફ મેડિકલ



ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક સાહિત્ય સરિતા-આયોજક : પ્રદીપ રાવલ

ફોટો ગેલેરી



મહારાષ્ટ્ર સરકારે કોરોના વેક્સીનેશન પર ૧૮ જાન્યુઆરી સુધી લગાવ્યો પ્રતિબંધ

મુંબઈ,તા.૧૭
મહારાષ્ટ્ર સરકારે કોરોના વાયરસ સામે ચાલી રહેલા વેક્સીનેશન અભિયાનને બે દિવસ માટે અટકાવ્યું છે. વેક્સીનેશન અભિયાન પર ૧૮ જાન્યુઆરી સુધી મહારાષ્ટ્રમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોવીન એપમાં તકનીકી સમસ્યાઓના કારણે આ કાર્યક્રમ પર રોક લગાવી છે. અડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ કહ્યું કે કોવીન એપમાં કેટલીક તકનીકી સમસ્યાઓ છે, જેને સુધારવી પડશે. આ રિવાજ અને સોમવારે રાજ્યમાં કોરોના વેક્સીન આપવામાં આવશે નહીં. તેમને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે, ૧૮ જાન્યુઆરીથી વેક્સીનેશન ફરી શરૂ થશે, તો તેના પર સુરેશ કાકાનીએ કહ્યું કે, હજુ કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી અને હવે પછી વધુ જાણકારી શેર કરવામાં આવશે. બીએમસીના અનુસાર પહેલા દિવસે વેક્સીનેશન અભિયાનને શરૂ કરતા સમયે કોવીન એપમાં કેટલીક તકનીકી સમસ્યાઓ સર્જાઈ હતી. વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર તેમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, દેશમાં કોરોના વેક્સીનેશન અભિયાનની શરૂઆત શનિવાર કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, વેક્સીનેશન અભિયાનના પહેલા દિવસે દેશમાં ૧.૮૧ લાખ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, વેક્સીનેશન માટે ૩,૩૫૧ સેન્ટર બનાવવામાં આવ્યા છે. આ વેક્સીનેશન સેન્ટર પર ૧૬,૭૫૫ આપવામાં આવશે નહીં. તેમને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે, ૧૮ જાન્યુઆરીથી વેક્સીનેશન ફરી શરૂ થશે, તો તેના પર સુરેશ કાકાનીએ કહ્યું કે, હજુ કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી અને હવે પછી વધુ જાણકારી શેર કરવામાં આવશે. બીએમસીના અનુસાર

કોંગ્રેસમાં રાહુલ ગાંધીની તાજપોશી ફેબ્રુઆરીમાં થાય તેવી સંભાવના

ન્યુ દિલ્હી,તા.૧૭
નેતૃત્વના શૂન્યાવકાશનો સામનો કરતી કોંગ્રેસ ફરી એકવાર પશ્ચિમ સુકાન રાહુલ ગાંધીને સોંપી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેબ્રુઆરીમાં રાજસ્થાનના નીમરાના અથવા જેસલમેરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાઈ શકે છે. આ દરમિયાન રાહુલ ગાંધીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ શકે છે. ૧૬ ડિસેમ્બર, ૨૦૧૭થી ૧૦ ઓગસ્ટ, ૨૦૧૯ સુધી રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ હતા. લોકસભા ચૂંટણીમાં પશ્ચિમી ઘાટ ભાદ તેમજ રાજ્યના આ પીઠાઈ હતું. એ વખતે પશ્ચિમ રિજિન નેતાઓની સમજાવટ પછી તેમણે કોંગ્રેસ અધ્યક્ષનો હોદ્દો સંભાળવાનો ઈનકાર કરી દીધો હતો. બે મહિના પહેલા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના કામકાજ અંગે કટલાક પ્રશ્નો ઊભા કર્યા હતા. આશરે બે મહિના અગાઉ

ગુલામ નબી આઝાદે પશ્ચિમ કામકાજ અંગે કટલાક પ્રશ્નો ઊભા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ફાઈવ સ્ટાર કલ્ચરથી ચૂંટણી જીતી શકાતી નથી. આજે નેતાઓ સાથે મોટી મુશ્કેલી છે કે જેમને ટિકિટ મળી જાય છે તેઓ સૌથી પહેલા ફાઈવ સ્ટાર હોટેલ બુક કરાવે છે. જો માર્ગ પરાબ છે તો તે તેની ઉપર જશે નહીં. આઝાદે કહ્યું હતું કે જ્યાં સુધી આ કલ્ચર હોડવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ ચૂંટણી જીતી શકાશે નહીં. છેલ્લા ૭૨ વર્ષમાં કોંગ્રેસ તેના સૌથી નીચા સ્તર પર આવી ગઈ છે. કોંગ્રેસ પાસે છેલ્લા બે કાર્યકાળ દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતાનું પદ પણ નથી. કેટલાક મહિના અગાઉ પશ્ચિમ નેતાઓએ આ મુદ્દે સોનિયા ગાંધીને એક પત્ર પણ લખ્યો હતો. તેમા કપિલ સિંબલ ઉપરાંત ગુલામ નબી આઝાદનો પણ સમાવેશ થતો હતો.

?? ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ મેમ્બરો ની ગત સપ્તાહ ના વિષય " ૨૦૨૧ નું વર્ષ,પ્રેમભાવ,બદલાતી જીવન શૈલી," વિષયક છેલ્લી ગદ્ય રચનાઓ ને અહી પ્રસિદ્ધિ આપવામાં આવી છે..હવે પછી આવતીકાલ થી ગત રવિવારે આપેલ વિષય ઉપર લખવામાં આવેલી રચનાઓ પ્રસિદ્ધ થશે. અખબાર તેમજ ગ્રુપ વિષયક માહિતી માટે સંપર્ક. www.janfarriadnews.com Email : prdpraval42@gmail.com What's up calling: 9824653073

ન્યૂઝ ઓફ ગાંધીનગર સાહિત્ય સરિતા NOG SS No :- 0052

પ્રકાર : ગદ્ય
વિષય/શીર્ષક : પ્રેમભાવ
લખવું તો શું લખવું? ઘણાં દિવસોથી એક જ સવાલ,પરેશના મનમાં દોડી રહ્યો હતો.
"ખબર નહીં આ છોકરો રુમમાં પુરાઈને,રામ જાણે શું કર્યા કરે છે,મને તો ઈ જ નથી ખબર પડતી.શું થશે આ છોકરાનું?"
ઈ તો મારો ઠાકોર જ જાણે,સ્વીચ દબાવતાં મમતા બદલે બદલી રહ્યા હતાં.
"કોલેજનાં છેલ્લા વર્ષમાં છે પણ હજુ તેની ટેવ ગઈ નથી." રોજરોજ બેલ વગાડી નીચે બોલવાનું ,કાલાવાલા કરવાનાં....
"અરે ! મોમ હું આવી ગયો જો.."
અને આટલી શાની ચિંતા કરે છે તું મારી ?મારે કોલેજમાં એક સ્પર્ધા છે અને તેનો વિષય અગાઉથી નક્કી કરી તેમાં ભાગ લેનારાઓને આપી દેવામાં આવ્યો છે હવે તેના પર શું લખું?ક્યાંથી લખું મતલબ કે શરુઆત ક્યાંથી કરું? તેનો વિચાર મારી જાતને રુમમાં પુરી મથી રહ્યો છું..
"ઠીક છે , હવે જલદીથી નાસ્તો કરી લે ,કોલેજ જવાનો સમય પણ થઈ ગયો છે.વળી નાસ્તો કર્યા વિના પાછો જતો રહીશ તો ભૂખ લાગશે , બહારનું ખાઈને તું પાછો બિમાર પડીશ."
"તું પણ શું ચાર...તાકાં ભાષણ બંધ થવાનું ક્યારેય નામ જ નથી લેવું."
"બહુ મોટો હોં...ગમે તેલો મોટો થા પણ મારા માટે તું છોકરું જ રહેવાનો."
પરેશ નાસ્તો પતાવી ઉતાવળ કરી નીકળતો જ હતો ત્યાં ફરી ટકોર થઈ "શાંતિથી બાઈક ચલાવજે સહેજપણ ઉતાવળ કરતો નહીં."
"એ હા મોમ..બાય.."

કોલેજ પહોંચી તે લાઈબ્રેરીમાં જઈ બેઠો. તેની નજર સામે પડેલી એક ટુક પર પડી ,કવર સામાન્ય હતું પણ તેના પર રહેલ ચિત્ર જોઈ તે મનોમન

દરખાચો.
"અરે !હું પણ કેટલો ભુલુ છું,પ્રેમ શબ્દ પર લખવા માટે મારી પાસે મા નામની આખી લાઈબ્રેરી પડી છે.શું કામ હું બીજે ફાંફા મારી રહ્યો છું."
પૃથ્વી પર જીવન ટકી રહેવા પ્રાણવાયુ જેટલો જ પ્રેમભાવ જરૂરી છે .માનવી આ ભાવની મહત્તા સમજે તો ધરા ધરી પર ધૂમતી રહે !
માયા દેસાઈ ,મુંબઈ ભારત.

સંજય તરબદા "સાંજ",વડોદરા

NOG SS NO.081

વિષય : પ્રેમભાવ
શીર્ષક : પ્રેમભાવ
પ્રકાર : ગદ્ય
પ્રેમભાવ એ એવી અદ્ભુત લાગણી છે જે દુશ્મનને પણ દોસ્ત બનાવી દે.આ લાગણી માતા- સંતાન વચ્ચે,પતિ -પત્ની વચ્ચે, મિત્રો વચ્ચે કે માનવ - પ્રાણી વચ્ચે વહેતી હોય છે. એમાં એકબીજાને સમજી લેવાની તત્પરતા અને સહજતા મુખ્ય સ્થાને હોય છે.

દેશ માટે જનની બાજુ લગાડનારા જવાનોનો પ્રેમભાવ ખૂબ ઉચ્ચ કોટીનો હોય છે . એમાં માલોમની રક્ષા અને આબરૂ સર્વોપરિ હોય તેથી બીજાં દરેક સંબંધને તેઓ ગોણ ગણે છે.
પ્રેમ એ એક એવી સરવાણી છે જે કેટલીક વાર આપણા સહજ વર્તનથી પણ સામેની વ્યક્તિ કે પ્રાણીનાં દિલમાં વહેતી થઈ જાય છે.એકાદ શ્રવાન કે બિલાડીને જરા અમથી સહાનુભૂતિ દેખાડતાં અજાણે જ એમનો પ્રેમ વહેતો થઈ જાય છે.એકાદ વ્યક્તિ સાથે પણ કોઈ અણબૂનબંધથી આવી અનુભુતિ થાય છે.વધુ કંઈ નહીં ,બસ,બે આશાભર્યા શબ્દો કે એકાદ પ્રેમભરી પૂછપરછ.
એક આવી સરળ વ્યક્તિના જીવનમાં પ્રેમ ખૂબ અદમ ભૂમિકા ભજવી..એક કારખાનામાં કામ કરતો એ માણસ ખૂબ સાલસ હતો.કોઈ શરતચૂકથી એક દિવસ એ જ્યાં કામ કરતો એ વિભાગના દરવાજા બંધ કરી સૌ ઘેર ગયાં.એણે તનતોડ પ્રયત્નો કરી બેચાં બહાર નીકળવા માટે ,પણ વ્યર્થ.ઈશ્વરને સોંપી એ કારખાનામાં બેસી રહ્યો.
નિયત ફરજ પ્રમાણે પેલો ચોકીદાર પણ છેલ્લી વાર તપાસી દરવાજા બંધ કરી રહ્યો હતો ત્યારે એને કશું યાદ આવ્યું.એક પછી એક બંધાં દરવાજાઓ ખોલી પેલો માણસ જ્યાં કામ કરતો ત્યાં આવ્યો. ઈશ્વરે અરજ સાંભળવાની પ્રતીતિ થઈ.આભાર માનતાં એણે ચોકીદારની વાત સાંભળી તો ચકિત થઈ ગયો. ચોકીદારે જણાવ્યું કે ઘેર જતી વખતે એ માણસ હંમેશા એને ?શુભેચ્છા આપતો.આખા કારખાનામાં એ એક જ વ્યક્તિ આવી પ્રેમ દર્શાવતી, તેથી એને છેલ્લે દરવાજા બંધ કરતાં એ શુભેચ્છા યાદ આવી.તેથી એને ખ્યાલ આવ્યો કે સવારે એ માણસ હાજર થયો

તો જતાં મને ન મળી શક્યો.આ એક ખૂબ સામાન્ય વાત એક માણસને કેવી જીવવાની તક અને અમાપ આશા આપી ગઈ એની ઘોતક છે .
પૃથ્વી પર જીવન ટકી રહેવા પ્રાણવાયુ જેટલો જ પ્રેમભાવ જરૂરી છે .માનવી આ ભાવની મહત્તા સમજે તો ધરા ધરી પર ધૂમતી રહે !
માયા દેસાઈ ,મુંબઈ ભારત.

વર્તમાન સમયમાં

NOG સાહિત્ય સરિતા ગ્રુપ - ૧ NG.NO. - 0034

વિષય : બદલાતી જીવનશૈલી
વિભાગ : ગદ્ય (પત્રલેખન)
શીર્ષક : દાદાજીનો પત્ર
વ્હાલા મંગલમ,
ખૂબ ખૂબ પ્રેમ સાથે શુભાશિષ. "
તું ઘરેથી ઘણો દૂર ઉચ્ચ અભ્યાસ માટે ગયો છે અને ત્યાં તને ઘર પરિવારની ખૂબ જ યાદ આવે છે. તેથી જ મને થયું કે આજે ફોનથી નહીં પરંતુ પત્રથી તારી સાથે વાત કરું. નવાઈ લાગી ને!
આ મારો પ્રેમ પણ છે અને આશીર્વાદ પણ. જીવનમાં કંઈક પામવા માટે થોડોક સંઘર્ષ તો કરવો જ પડે. આપણે ત્યાં તો સદીઓથી ગુરુકુળ પરંપરા ચાલી આવી છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ સાંદિપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા હતાં. જીવનનાં અઘરાં પાઠ તો ગુરુ જ શીખવાડી શકે.

પહેલાંનાં સમયની સાથે અત્યારનાં સમયની સરખામણી કરવાનો મારો હેતુ નથી. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વાત લખી રહ્યો છું. આજે જે પ્રમાણે યુવાનો આધુનિક જીવનશૈલીનો અતિરેક કરી રહ્યાં છે એ જોઈને ખૂબ જ દુઃખ થાય છે. રાત્રે મોડે સુધી જાગવું અને સવારે મોડાં ઉઠવાનું, ખાવા પીવામાં પણ તદ્દન લાપરવાહી રાખવી. ફાસ્ટફૂડ જ ગમે, બસ ખાવું, પીવું અને મોજમસ્તી કરવી એ જ એમનો જીવનમંત્ર બની ગયો હોય એવું લાગે છે. સમય અનુસાર બદલાવું એ જરૂરી છે પરંતુ પરિવર્તન વિનાશકારી તો ન જ હોવું જોઈએ. કેમ બરોબર ને દીકરા? આજે મારે વાત કરવી છે, મોઠાઈબળાં અતિરેકની મોઠાઈબળાં આધિકાર ખરેખર તો આશીર્વાદ સમાન છે. મોઠાઈબળ આપતાં જ જાણે કે,' કર લો દુનિયા મુઠીમે' એવી અનુભૂતિ થાય. પરંતુ નાનાં બાળકોને એમાં ગળાડૂબ જોઈને ચિંતા પણ થાય. ટેકનોલોજીનો સારો ઉપયોગ કરવો એ સારી બાબત છે પણ તેનો અતિરેક તો યોગ્ય નથી.
પહેલાંના સમયમાં માહિતીનું કે કોઈ સંદેશનું આદાન પ્રદાન કરવા માટે સંદેશાવાહક હતાં. અરે, ઘણીવાર તો કબૂતરોનો પણ ઉપયોગ કરવામાં આવતો. પરંતુ પરિવર્તન તો સંસારનો નિયમ છે. દરેક વસ્તુમાં પરિવર્તન આવતું ગયું. તાર, ટપાલ, ફોન વગેરેથી એકબીજાનું અંતર

દટવું. એમાંય મોઠાઈબળ આપતાં ખૂબ સરળતાથી એકબીજાનો સંપર્ક કરી શકાય છે, વિશ્વના કોઈપણ ખૂણેથી! એક સ્માર્ટ ફોનમાં કેટલું બધું છે. દરેક સુવિધાઓ પળમાં ઉપલબ્ધ થાય છે. તેથી જ યુવા પેઢીને તેનું આટલું ઘેલું છે ને! પણ તેનો યોગ્ય ઉપયોગ કરવો એ પણ જરૂરી છે. " અવિવેક આપતિનું મૂળ છે."

વર્તમાન સમયમાં

NOG સાહિત્ય સરિતા ગ્રુપ-૧ NOG SS NO.0031

શબ્દ:-બદલાતી જીવનશૈલી
શીર્ષક:-સમજણ
પિસ્તાલીસ વર્ષના કમલભાઈ રોહિતસથી સાંજે ઘરે આવે એટલે એક જ ફરિયાદ હોય ,મને સપત એસીડિટી ઊપડી છે અને એના લીધે તેમનો સ્વભાવ પણ ચિડિયો થઈ ગયેલો.જ્યારે પણ ડોક્ટર પાસે જાય ત્યારે એકઅપ કરાવતાં બ્લડપ્રેશર પણ હાઈ જ આવે.ડોક્ટર એમને તીખું ,તળેલું , બહારનું મરી મસાલા વાળું ખાવાની સૂચના ના પાડે. પણ ચટપટું ખાવાના શોખીન કમલભાઈ કોઈની વાત ના માને એટલે શરીરમાં કોઈને કોઈ બિમારી રહ્યાં જ રાખે.ત્યાં અચાનક લોકડાઉન થયું અને એમનું બહારનું ખાવાપીવાનું સાવ ઘરની માફકસર મરી મસાલા વાળી રસોઈ જરાપણ ના ભાવે,પણ શું થાય બહાર બહુ બંધ હોવાથી ફરિયાદ ઘરે જમવું પડે.પણ થોડા દિવસ ઘરે જમ્યા ત્યાં એમને લાગ્યું કે બહારનો નાસ્તો કંઈ પેટમાં ના જતો હોવાથી એમને એસીડિટી ના થતી.
માફકસર ખોરાક જમવાથી બી.પી.પણ કંટ્રોલમાં રહેવા લાગ્યું.આખો દિવસ ઘરમાં જ રહેવાથી એ કંટાળી જતાં એટલે સવારે વહેલા ઉઠીને એ પોતાની અગાશીમાં કસરત કરતાં એથી એમનું શરીર પણ સ્કૂર્તિમાં રહેતું અને કમલભાઈની તબિયત આમ સારી રહેતી હોવાથી તે પોતે પણ ખુશ રહેવા લાગ્યા.

પછી તો લોકડાઉન ખુલી ગયું તો પણ કમલભાઈએ પોતાની? જીવનશૈલી લોકડાઉન સમયે રાખી હતી


તેવી જ રાખી.કેમકે હવે તેમને સમજાઈ ગયું હતું કે એ રીતે રહેવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. સરસ મેઘલ કિશોરભાઈ ઉપાધ્યાય'મેલુ'રાજકોટ

NOG સાહિત્ય સરિતા ગ્રુપ(૧) NOG SS No-0042

વિભાગ-ગદ્ય

પ્રકાર-બાળવાર્તા
શીર્ષક-પ્રાણી પ્રત્યે પ્રેમભાવના
એક વરસાદી સાંજે પ્રહિલ તેના મિત્રો સાથે વરસાદમાં નાહીને પાછો ફરતો હતો ત્યારે તેને રસ્તામાં ઝાડ નીચે એક બિલાડીનું બચ્ચું કંડીથી ધૂજવું દેખાયું. પ્રહિલને તેનાં પર દયા આવી. નજીક જઈ તેને ઉંચકીને ઘરે લઈ આવ્યો ને દાદીને બૂમ પાડી "દાદી જુઓ આપણાં ઘરે કોણ આવ્યું?" દાદીએ કહ્યું,"પ્રહિલ આ બચ્ચાને કેમ ઘરે લાવ્યો તેની મા તેને શોધતી હશે." પ્રહિલે તરત જવાબ આપ્યો,"દાદી,એ એકલું હતું અને કંડીથી ધૂજવું હતું વળી તમે શીખવ્યું હતુંજે?જીવ માત્ર માટે દયાભાવના રાખવી જોઈએ એટલે ઘરે લાવ્યો." દાદીએ ગરમ હુંફાળું દૂધ પાણી તેમાં સુવડાવી દીધું અને બોલ્યું પોરમાં મૂકી દીધું.
સવાર થતાં પ્રહિલ ઉઠીને સીધો પોરમાં ગયો ત્યાં બિલાડીનું બચ્ચું તેનાં પગે વીટળાઈ વ્હાલ કરવા લાગ્યું. પ્રહિલના દાદી આવીને કહેવા લાગ્યા,"હવે આનું શું કરશું? તેની મા વગર કેમ જીવાડશું!" પ્રહિલ બોલી ઉઠ્યો "દાદી પેલા ઝાડ નીચે જઈને જોઈ? કદાચ તેની મા શોધવા આવી હોય." દાદીએ હા પાડતા પ્રહિલ ઝાડ નીચે ગયો ત્યાં એક ભૂરા કલરની બિલાડી ધ્યાઈ.. ધ્યાઈ કરતી તેનાં બચ્ચાને શોધતી હોય તેવું લાગ્યું. પ્રહિલ તેને ઉંચકીને ઘરે લઈ આવ્યો અને બચ્ચાની બાજુમાં લઈ ગયો.

બચ્ચું તેની માને જોતાં ગેલમાં આવી ગયું અને બિલાડી પણ પોતાનાં બચ્ચાને જોઈ વ્હાલ કરવા લાગી. પ્રહિલે દાદીને પૂછ્યું,"દાદી આપણે આ બંનેને પાળી લઈશું? મેં તો નામ પણ વિચારી રાખ્યું છે. ભૂરી અને દીનું"દાદીએ હા પાડી કારણકે પ્રેમભાવના માણસ માટે જ દર્શાવવી એ જરૂરી નથી. પ્રાણી પ્રત્યે પણ સંવેદના હોવી જોઈએ પ્રાણી પણ પ્રેમની ભાષા સમજે છે.
પૂજા(અલકા)કાનાણી મીઠાપુર.



સંજય તરબદા સાંજ
માયા દેસાઈ
શુભેચ્છા આપતો
ઓભણા આમણી

રાજકારણીઓને પેન્શન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ અમેરિકાએ રિપોર્ટ રજૂ કરીને વુહાનની વાયરોલોજી ઈન્સ્ટિટ્યૂટ પર ઉઠાવ્યા સવાલો

હવે નેતાઓના નેતાંએ સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરી છે, તેને તમારા આકારણી માટે મોકલી છે .. ભારતના પ્રિય / આદરણીય નાગરિકો ... તમને આ સંદેશ વાંચવા વિનંતી છે અને જો તમે સંદેશ યાચો તો કૃપા કરીને તમારા સંપર્કમાં બધા લોકોને મોકલો અને બદલામાં તેઓને આગળ પણ આગળ વધારવા માટે કહો.
ત્રણ દિવસમાં, આ સંદેશ આખા ભારતમાં હોવો જોઈએ. દરેક નાગરિકે ભારતમાં અવાજ ઉઠાવવો જોઈએ. ∞
૨૦૧૮ ઈમ્પુલ્સન્ટ એક્ટ સાંસદોને પેન્શન ન મળવું જોઈએ કારણ કે રાજકારણ એ નોકરી કે રોજગાર નથી, પરંતુ મફત સેવા છે. - રાજનીતિ એ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળની ચૂંટણી છે, ત્યાં કોઈ નિવૃત્તિ નથી, પરંતુ તે જ પરિસ્થિતિમાં ફરીથી ચૂંટાઈ આવી શકે છે. (હાલમાં તેઓ ૫ વર્ષની સેવા પછી, પેન્શન મેળવે છે).
આમાં વધુ એક અવ્યવસ્થા એ છે કે જો કોઈ વ્યક્તિ પહેલા કાઉન્સિલર રહે છે, તે પછી ધારાસભ્ય બને છે અને પછી સાંસદ બને છે, તો તેને એક નહી પણ ત્રણ પેન્શન મળે છે.
દેશના નાગરિકો સાથે આ એક મોટો વિશ્વાસઘાત છે જેને આને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવી પડશે ...
સેન્ટ્રલ પગાર પંચ સાથે સાંસદોના પગાર ભથ્થામાં સુધારો કરવામાં આવી રહ્યો છે આને આવકવેરા હેઠળ લાવવો જોઈએ
હાલમાં સાંસદો પોતાનો મત આપીને મનસ્વી રીતે તેમના પગાર અને ભથ્થામાં વધારો કરે છે અને તે સમયે તમામ પક્ષો એક થઈ ગયા છે.
સાંસદોની આરોગ્ય સંભાળની પદ્ધતિને રદ કરવી જોઈએ .. અને ભારતના જાહેર આરોગ્યની જેમ આરોગ્યની સંભાળ તેમને અન્ય કોઈ નાગરિકની જેમ સંભાળ લેવી જોઈએ .. હાલમાં તેમની સારવાર

ઘણીવાર વિદેશમાં પણ કરવામાં આવે છે .. જો તેમને તે વિદેશમાં કરાવવું હોય તો તેઓએ તે મેળવી લેવું જોઈએ. તેમના પોતાના ખર્ચે કરવામાં તેમને બધી છૂટછાટો, જેમ કે, વીજળી, પાણી અને ફોન બિલ સમાપ્ત થવું જોઈએ. (તેઓને આવી ઘણી છૂટછાટો જ મળે છે પરંતુ તે નિયમિત રૂપે પણ વધે છે) - ગુનેગારોને ચૂંટણી લડતા અટકાવવું જોઈએ, શિક્ષાત્મક રેકોર્ડ, ગુનાહિત આરોપો અને નિશ્ચય, ભૂતકાળ કે વર્તમાન સાથેના શંકાસ્પદ વ્યક્તિઓને સંસદમાંથી પ્રતિબંધ મૂકવો જોઈએ ..
Officer V, માં રાજનેતાઓને કારણે તેમના દ્વારા થતા આર્થિક નુકસાન, તેમની પાસેથી નામાંકિત, સંપત્તિ - સાંસદોએ પણ સામાન્ય નાગરિકોને લાગુ પડેલા સમાન નિયમોનું પાલન કરવું જોઈએ.
નાગરિકો દ્વારા એલપીજી ગેસ સબસિડી પર કોઈ કપાત નહીં ... જ્યાં સુધી સાંસદ અને ધારાસભ્યોને મળતી સબસિડી

અને સંસદના કેન્ટીનમાં સબસિડીવાળા ખોરાક સહિતની અન્ય સબસિડી પાછી ખેંચી લેવામાં નહી આવે.
સંસદમાં સેવા આપવી એ સન્માન છે, લૂંટ ચલાવવાની આકર્ષક કારકિર્દી નહીં. મફત રેલ્વે અને વિમાન મુસાફરી બંધ થવી જોઈએ.
સામાન્ય માણસોને તેમની મજા કેમ સહન કરવી પડે છે? જો દરેક વ્યક્તિ ઓછામાં ઓછા વીસ લોકો સાથે વાતચીત કરે છે, તો ભારતના મોટાભાગના લોકો આ સંદેશ મેળવવા માટે ફક્ત ત્રણ દિવસનો સમય લેશે. શું તમને નથી લાગતું કે આ મુદ્દે ઉઠાવવાનો આ યોગ્ય સમય છે? જો તમે ઉપરોક્ત સાથે સંમત છો, તો પછી તેને આગળ ધપાવો.
જો નહિં, તો ફક્ત તેને કા .ી નાખો. તમે મારા ૨૦ માંથી એક છો, કૃપા કરીને આ ચાલુ રાખો ... આભાર.

વોશિંગટન,તા.૧૭
કોરોના વાયરસને લઈને ચીન પર પ્રહારો કરી રહેલા અમેરિકાએ એક રિપોર્ટ રજૂ કરીને વુહાન સ્થિત વાયરોલોજી ઈન્સ્ટિટ્યૂટ પર કેટલાંય પ્રશ્નો ક્યા છે અને ઉડાણપૂર્વક તપાસની માંગણી કરી છે. અમેરિકન ગૂલ વિભાગના આ રિપોર્ટમાં અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીએ વ્યવસ્થિત રીતે કોવિડ-૧૯ મહામારીની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે અંગેની પારદર્શિતાની સાથે તપાસ થતા રોક્યા અને જુદાંજુદાં ફેલાવામાં પોતાની તાકાત લગાવી દીધી. અમેરિકાએ સીધો ઘાવો કર્યો નથી કે વાયરસ ચીનથી ફેલાયો છે પરંતુ પ્રાણીઓથી લઈ માણસોમાં ફેલાવાથી લઈ લેબમાં થયેલ ઘટનાથી લઈ લીક સુધી કેટલીય સંભાવનાઓનો

ઉલ્લેખ કર્યો છે અને તપાસની માંગણી કરી છે. 'Fact sheet: Activity at Wuhan Institute of Virology' નામના રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકન સરકાર પાસે માનવા માટે એ પૂરતા કારણો છે કે વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીએ વ્યવસ્થિત રીતે કોવિડ-૧૯ મહામારીની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે અંગેની પારદર્શિતાની સાથે તપાસ થતા રોક્યા અને જુદાંજુદાં ફેલાવામાં પોતાની તાકાત લગાવી દીધી. અમેરિકાએ સીધો ઘાવો કર્યો નથી કે વાયરસ ચીનથી ફેલાયો છે પરંતુ પ્રાણીઓથી લઈ માણસોમાં ફેલાવાથી લઈ લેબમાં થયેલ ઘટનાથી લઈ લીક સુધી કેટલીય સંભાવનાઓનો ઉલ્લેખ કર્યો છે અને તપાસની માંગણી કરી છે. 'Fact sheet: Activity at Wuhan Institute of Virology' નામના રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકન સરકાર પાસે માનવા માટે એ પૂરતા કારણો છે કે વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીએ વ્યવસ્થિત રીતે કોવિડ-૧૯ મહામારીની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે અંગેની પારદર્શિતાની સાથે તપાસ થતા રોક્યા અને જુદાંજુદાં ફેલાવામાં પોતાની તાકાત લગાવી દીધી. અમેરિકાએ સીધો ઘાવો કર્યો નથી કે વાયરસ ચીનથી ફેલાયો છે પરંતુ પ્રાણીઓથી લઈ માણસોમાં ફેલાવાથી લઈ લેબમાં થયેલ ઘટનાથી લઈ લીક સુધી કેટલીય સંભાવનાઓનો ઉલ્લેખ કર્યો છે અને તપાસની માંગણી કરી છે. 'Fact sheet: Activity at Wuhan Institute of Virology' નામના રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકન સરકાર પાસે માનવા માટે એ પૂરતા કારણો છે કે વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીએ વ્યવસ્થિત રીતે કોવિડ-૧૯ મહામારીની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે અંગેની પારદર્શિતાની સાથે તપાસ થતા રોક્યા અને જુદાંજુદાં ફેલાવામાં પોતાની તાકાત લગાવી દીધી. અમેરિકાએ સીધો ઘાવો કર્યો નથી કે વાયરસ ચીનથી ફેલાયો છે પરંતુ પ્રાણીઓથી લઈ માણસોમાં ફેલાવાથી લઈ લેબમાં થયેલ ઘટનાથી લઈ લીક સુધી કેટલીય સંભાવનાઓનો ઉલ્લેખ કર્યો છે અને તપાસની માંગણી કરી છે. 'Fact sheet: Activity at Wuhan Institute of Virology' નામના રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકન સરકાર પા

ગાંધીનગર જિલ્લામાં એક જ દિવસે ૪૩ દાતાઓએ શ્રી રામ જન્મભૂમિ નિર્માણ માટે આપ્યું રૂ.૬૧ લાખનું દાન

આશિષ ભટ્ટ દ્વારા- ગાંધીનગર:

મકરસંક્રાંતિ પર્વના બીજા જ દિવસે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા મંદિર માટે નિધિ સમર્પણ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. ત્યારે ગાંધીનગર સેક્ટર-૭ ખાતે સંતોની ઉપસ્થિતિમાં ભારત માતા મંદિરે પણ નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ ટ્રસ્ટો અને અનેક દાતાઓએ શ્રી રામ જન્મભૂમિ માટે દાન આપ્યું હતું. જેમાં તારીખ ૧૫-૦૧-૨૦૨૧ ના દિવસે એક જ દિવસમાં જિલ્લાભરના કુલ ૪૩ દાતાઓએ કુલ રૂપિયા ૬૧ લાખનું દાન આપી દાનની ધારા વહાવી હતી.

આ તકે, પોલીસ આવાસ નિગમ ના ચેરમેન ડી. ડી. પટેલ મુખ્ય દાતા રહ્યા હતા. જેમણે રૂ. ૨૧, ૧૧, ૧૧૧ નો ચેક અર્પણ કર્યો હતો. જ્યારે શ્રી હનુમાનજી મંદિર ટ્રસ્ટ-૩ભોળા દ્વારા રૂ.૫૧,૦૦૦, ઉમિયા માતાજી સંસ્થાન કેન્દ્ર (સેક્ટર ૧૨ ગાંધીનગર) તરફથી રૂ.૧૧,૧૧૧ વિહિપ રામ મંદિર



સમર્પણ નિધિ અધ્યક્ષ અને ગાંધીનગર એપીએમસીનાં ચેરમેને ૧,૦૦,૦૦૧ રૂપિયાનું દાન કર્યું હતું. પૂર્વ ભાજપ પ્રદેશમંત્રી જગદીશભાઈ પ્રતાપજી ઠાકોરે ૧,૧૧,૧૧૧, વિઘ્નેશ્વરી પરીવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧લાખ, ગાંધીનગરના એડવોકેટ બી.આર. શર્મા દ્વારા ૧ લાખ, બિહાર પ્રમુખભાઈ ડી. પટેલે ૧ લાખ એમ જિલ્લાભરના કુલ ૪૩ દાતાઓએ શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે કુલ રૂપિયા ૬૧ લાખનું દાન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય કુલ શંકર શાસ્ત્રીજી, પરમ પૂજ્ય મહામંડલેશ્વર રામમનોહરદાસજી, પરમ પૂજ્ય રામસ્વામી, પરમ

ત્રિશા હોસ્પિટલ ખાતે દુનિયાનો સર્વ શ્રેષ્ઠ 'કની રિપ્લેશમેન્ટના' રોબોટનું લોન્ચિંગ કરાયું

અમદાવાદ,તા.૧૭ ગુજરાતમાં પ્રથમ વાર અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલ ખાતે દુનિયાનો સર્વ શ્રેષ્ઠ કનેક્ટિવિટી રોબોટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલના ડિરેક્ટર અને ચીફ ઓથોરિટી ડૉ.અલ્પેશ પટેલ આ રોબોટ વિષે વધુમાં જણાવે છે કે, ત્રિશા હોસ્પિટલની યાત્રા સખત મહેનત,પ્રતિબદ્ધતા અને દર્દીની સંભાળ પ્રત્યે સમર્પિત છે. દર્દીની સંભાળ પ્રત્યે સમર્પિત છે. દર્દીની સંભાળ પ્રત્યે સમર્પિત છે. દર્દીની સંભાળ પ્રત્યે સમર્પિત છે. દર્દીની સંભાળ પ્રત્યે સમર્પિત છે.

સાથોસાથ મહત્તમ ચોકસાઈ સાથે ઓપરેશન કરવામાં આવે છે. અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં આવેલી ત્રિશા હોસ્પિટલના ડિરેક્ટર અને ચીફ ઓથોરિટી ડૉ.અલ્પેશ પટેલ આ રોબોટ વિષે વધુમાં જણાવે છે કે, ત્રિશા હોસ્પિટલની યાત્રા સખત મહેનત,પ્રતિબદ્ધતા અને દર્દીની સંભાળ પ્રત્યે સમર્પિત છે. દર્દીની સંભાળ પ્રત્યે સમર્પિત છે. દર્દીની સંભાળ પ્રત્યે સમર્પિત છે. દર્દીની સંભાળ પ્રત્યે સમર્પિત છે.

રાજ્યમાં માસ વેક્સીનેશનની તૈયારીઓ એએમસી સંચાલિત ૪૦૦ શાળાઓમાં થશે વ્યવસ્થા



અમદાવાદ,તા.૧૭ ગુજરાત સહિત દેશભરમાં વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે હવે આરોગ્ય તંત્રએ શહેરની આમ જનતાને પણ ઝડપથી વેક્સીન મળે તેની પણ વ્યવસ્થા શરૂ કરી દીધી છે. માસ વેક્સીનેશન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સ્કૂલ બોર્ડની ૪૦૦ શાળાઓની યાદી તૈયાર કરી છે. આ રસીકરણ અભિયાનમાં સ્કૂલબોર્ડના ૬૦૦ શિક્ષકોને પણ કામગીરીમાં જોડવાની તૈયારી કરી છે. કોરોના વાયરસને નાથવા ટીકા કરણ

વેક્સીનેશન માટે મોકલવામાં આવી છે. આ અંગે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના ચેરમેન ધીરેન્દ્રસિંઘ તોમરએ જણાવ્યું કે, એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા અમારી પાસે શાળાઓની યાદી માગવામા આવી હતી. જેથી સ્કૂલબોર્ડ સંચાલિત ૪૦૦ શાળાઓની યાદી સોંપી છે. જ્યારે લોકોને રસી આપવાની થશે ત્યારે શાળાઓની જરૂર પડશે અને હાલમાં કોરોનાને લઈ સ્કૂલબોર્ડની પ્રાથમિક શાળાઓ બંધ છે. રસી લેવા માટે લોકોને નજીકનું સ્થળ પણ મળી રહે તેને લઈ શાળાઓમાં આ વ્યવસ્થા ગોઠવાય તેવી તંત્રની તૈયારી છે. મહત્વનું છે કે, કોર્પોરેશન સંચાલિત શાળાના શિક્ષકો અને જિલ્લા પંચાયત સંચાલિત શાળાના શિક્ષકોએ પણ કોરોનાના કપરા કાળમાં ઓર ટુ ઓર સર્વેથી માંડીને રાશન વિતરણ અને કોવિડ સેન્ટરમાં નોન કોવિડ જ્યુટીમાં કોરોના વોરિયર તરીકે ફરજ બજાવી હતી. જેને લઈ આવા શિક્ષકોને પણ રસી આપવાની યાદી આરોગ્ય તંત્રને મોકલવામાં આવી છે.

બંને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન સંસ્કૃતના જાણકાર પંડિતો દ્વારા નર્મદાષ્ટકમ તથા અન્ય વેદોક્ત મંત્રોચ્ચાર કરવામાં આવ્યા

કેવડિયા રેલવે સ્ટેશન તથા ૮ નવી ટ્રેનોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો શુભારંભ



રાજપીપલા, તા.૧૭ -સરદાર સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી પ્રતિમા "સ્ટેચ્યુ ઓફ યુનિટી" તથા તેની આસપાસ કેવડિયાના સંકલિત વિકાસના અનેકવિધ પ્રોજેક્ટ્સ બાદ હવે આજે એક નવા અધ્યાયનો શુભારંભ વડાપ્રધાનશ્રીને હસ્તે કરવામાં આવ્યો છે. કેવડિયા ખાતે મુખ્ય માર્ગ ઉપર તૈયાર થયેલા કેવડિયા રેલવે સ્ટેશનના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ, ડભોઈ જંકશન તથા ચાંદોદ રેલવે સ્ટેશનનો વડાપ્રધાનશ્રીએ આજે વર્ચુઅલ શુભારંભ કરાવ્યો છે. સાથે સાથે ૮ નવી ટ્રેનોનો પણ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો છે. આ શુભ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કેવડિયાને બ્રોડગેજ રેલ માર્ગથી ભારતીય રેલવેના વિશાળ નેટવર્કની સાથે જોડવાની સાથે જ વડોદરાથી સ્પેશ્યલ ટ્રેનનું પ્રસ્થાન થયું હતું જેમાં સામાજિક આગેવાનો, સરદાર સાહેબના પરિવારજનો, પદ્મશ્રી પદ્મભૂષણ એવોર્ડ વિજેતાશ્રીઓ, કલા-સાહિત્યજગતના અગ્રણીઓ તેમજ પ્રવાસન ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, આગેવાનો, ટોચના ધર્મગુરુઓ, અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, કેળવણીકારો - યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર્સ, પ્રિન્ટ - ઈલેક્ટ્રોનિક મિડિયાના અગ્રગણ્ય વ્યક્તિઓએ આ ટ્રેનમાં

ખાસ મહાનુભાવોએ પ્રવાસ કર્યો હતો. કેવડિયા રેલવે સ્ટેશન ઉપર ટ્રેનના આગમન સમયે અને તે પહેલાં ૧૧ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર, પોલિસ બેન્ડ દ્વારા નર્સરીની મુલાકાતે લઈ જવામાં સ્વાગત તેમજ આદિવાસી નૃત્યમંડળી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. બંને ટ્રેન (અમદાવાદ - કેવડિયા - અમદાવાદ તથા વડોદરા - કેવડિયા - વડોદરા) માં રાષ્ટ્રીય એકતા તથા "એક ભારત શ્રેષ્ઠ ભારત"ના થીમ આધારિત બ્રાન્ડીંગ કરવામાં આવ્યું હતું.

આજથી શરૂ થયેલી આ ટ્રેનમાં અલગ અલગ કોચમાં જેમાં અલગ અલગ કોચમાં યુનિટી ટ્રેસ ઈન ટ્રેસ ડાયવર્સિટી, યુનિટી ઈન ડાન્સ ડાયવર્સિટી, યુનિટી ઈન મ્યુઝિકલ ડાયવર્સિટી, યુનિટી ઈન કલ્ચરલ ડાયવર્સિટી, યુનિટી ઈન રિલિજિયસ ડાયવર્સિટી જેવા વિષયો આધારિત પ્રવાસીઓએ આજે યાદગાર પ્રવાસ કર્યો હતો. સરદાર સાહેબે કરમસદની જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તે શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા જુદીજુદી વેશભૂષામાં પ્રવાસ કર્યો હતો. બંને ટ્રેનોમાં મુસાફરી દરમિયાન સંસ્કૃતના જાણકાર પંડિતો દ્વારા નર્મદાષ્ટકમ તથા અન્ય વેદોક્ત મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કેવડિયા સ્ટેશન પર

કેવડિયા રેલવે સ્ટેશન જવાના માર્ગે પોલીસે વાહનો અટકાવતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા



રાજપીપળા, તા.૧૭ આજે કેવડિયા ખાતે નવનિર્મિત રેલવે સ્ટેશનની ઉદ્ઘાટન

મુખ્યમંત્રી અને રાજ્યપાલ કેવડિયા રેલવે સ્ટેશનની મુલાકાતે આવવાના હતા ત્યારે થોડીવાર માટે રેલવે સ્ટેશન તરફ જવાનો રસ્તો પોલીસે બંધ કરી દીધો હતો. જેને કારણે બંને બાજુ વાહનોની લાંબી લાંબી કતારો જામી હતી. અને ચક્રાવ્રમના દ્રશ્યો સર્જાયા હતા.

જેના કારણે મોટાભાગના વાહનચાલકો અટવાઈ ગયા હતા. અને મુશ્કેલીમાં મુકાયા હતા. મુખ્યમંત્રી રેલવે સ્ટેશન પર પહોંચી ગયા પછી તરત જ થોડી વાર માટે પૂર્ણ વાહન વ્યવહાર રાખેતા મુજબ ચાલુ કર્યો હતો. ત્યાં પોલીસનો કાફલો પાડી દેવામાં આવ્યો હતો. તસવીર : જ્યોતિ જગતાપ રાજપીપળા



બનાસકાંઠા જિલ્લા ખેડૂત મંડળ પાલનપુર દ્વારા ન્યૂન ઓફ ગાંધીનગર દૈનિક બનાસકાંઠા ના ઉચ્ચરો ચીફ નું સન્માન... ખૂબ ખૂબ આભાર



માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi જી દ્વારા કેવડિયા ખાતે મુખ્ય માર્ગ ઉપર તૈયાર થયેલા કેવડિયા રેલવે સ્ટેશનના અદ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ, ડભોઈ જંકશન તથા ચાંદોદ રેલવે સ્ટેશનનો વર્ચુઅલ શુભારંભ કરવામાં આવ્યો હતો. ૮ નવી ટ્રેનોને પણ લીલી ઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો હતો. કેવડિયાને બ્રોડગેજ રેલ માર્ગથી ભારતીય રેલવેના વિશાળ નેટવર્કની સાથે જોડવાની સાથે જ વાડોદરાથી સ્પેશ્યલ ટ્રેનનું પ્રસ્થાન થયું હતું જેમાં સામાજિક આગેવાનો, સરદાર સાહેબના પરિવારજનો, પદ્મશ્રી પદ્મભૂષણ એવોર્ડ વિજેતાશ્રીઓ, કલા-સાહિત્યજગતના અગ્રણીઓ તેમજ પ્રવાસન ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો, આગેવાનો, ટોચના ધર્મગુરુઓ, અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, કેળવણીકારો - યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર્સ, પ્રિન્ટ - ઈલેક્ટ્રોનિક મિડિયાના અગ્રગણ્ય વ્યક્તિઓએ આ ટ્રેનમાં

માણાવદર સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણુંક કરવા માંગ લીબુડા ગામના કોંગ્રેસ આગેવાન સુરેશભાઈ મોરીએ મુખ્યમંત્રી ને કરી રજૂઆત



હોવાથી સમયસર સારવાર મળી શકતી નથી તેમજ પ્રસૂતિ ના કેસો, અકસ્માતના કેસો, જૂનાગઢ શહેરમાં રીફર કરવામાં આવે છે. સુરેશભાઈ મોરી એ વધુમાં જણાવ્યું છે કે પંચાવન બેડની હોસ્પિટલ હોવા છતાં ડોક્ટરો ન હોવાથી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ધણા બોજ સહન કરવા પડે છે. અને બહારગામની હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડે છે જે મધ્યમ વર્ગના લોકોને પોસાય નહી જેથી માણાવદર સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક ડોક્ટરોની નિમણુંક કરવા આપ સાહેબને અમારી માનસર અરજ છે. તસવીર- અહેવાલ- જીજ્ઞેશ પટેલ માણાવદર